

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી

બ્લોક નં.૧૨, પહેલો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ (ધોરણ ૧ થી ૫)માં વિદ્યાસહાયક ભરતી અંગેની જાહેરાત
વર્ષ ૨૦૧૭-૧૮

જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ (ધોરણ ૧ થી ૫ - ગુજરાતી માધ્યમ) માં વિદ્યાસહાયકની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા મળેલ માંગણીપત્રક મુજબ ૧૩૦૦ જગ્યાઓ ભરવા માટે મેરીટ યાદી તૈયાર કરવા શિક્ષણ વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૧ ના ઠરાવ અને તા.૦૩/૦૫/૨૦૧૨ તથા તા.૧૮/૦૫/૨૦૧૨ના સુધારા ઠરાવો અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓન-લાઇન મંગાવવામાં આવે છે. (ટપાલ કે રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં) ઉમેદવારે અરજી તા.૦૪/૦૮/૨૦૧૭ થી તા.૧૪/૦૮/૨૦૧૭ દરમ્યાન આ કચેરીની વેબસાઇટ www.vidyasahayakgujarat.org ઉપર મુકવામાં આવેલ સુચના મુજબ ઓન-લાઇન કરવાની રહેશે.

જાહેરાત ક્રમાંક	જગ્યાનો પ્રકાર	ભરવાપાત્ર કુલ જગ્યાઓ	સામાન્ય	અનુ.જાતિ	અનુ.જન જાતિ	સા.શૈ. પછાત વર્ગ	કુલ પૈકી શારીરિક અશક્ત (PH) માટે અનામત
વિસભ-૦૧/૨૦૧૭-૧૮ પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫)	ઘટ	૨૩૨	૦	૪૭	૧૧	૧૭૪	૧૨
	સામાન્ય	૧૦૬૮	૭૩૩	૬૬	૪૮	૨૨૦	૩૧
	કુલ	૧૩૦૦	૭૩૩	૧૧૩	૬૦	૩૮૪	૪૩

-જિલ્લા શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત તથા શૈક્ષણિક લાયકતા, પગાર-ધોરણ, વયમર્યાદા, વય મર્યાદામાં છુટછાટ, સામાન્ય સૂચનાઓ, સ્વીકાર કેન્દ્રોની યાદી અને જરૂરી ઠરાવોઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

ભરતી અંગેની સામાન્ય સુચનાઓ :

- (૧) વિદ્યાસહાયક ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ www.vidyasahayakgujarat.org ઉપર તા.૦૪/૦૮/૨૦૧૭ સવારના ૧૧.૦૦ કલાકથી તા.૧૪/૦૮/૨૦૧૭ના રોજ બપોરના ૧૫.૦૦ કલાક સુધી ભરી શકાશે.
- (૨) ઓનલાઇન ભરેલ અરજી પત્રકની પ્રિન્ટ કરેલી કોપી સ્વીકાર કેન્દ્ર ઉપર તા.૦૪/૦૮/૨૦૧૭ થી તા.૧૪/૦૮/૨૦૧૭ સુધી સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી નિયત ફી ભરી રૂબરૂ જમા કરાવવાનું રહેશે. જમા કરાવ્યા સિવાયનું અરજીપત્ર ગ્રાહ્ય રહેશે નહીં.
- (૩) વિદ્યાસહાયક તરીકે પસંદગી પામનાર તમામ ઉમેદવારોને રાજ્ય સરકારના નામદાર સુપ્રિમકોર્ટમાં દાખલ કરેલ એસ.એલ.પી.નં. -૧૪૧૨૪-૧૪૧૨૫/૨૦૧૨ તથા એસ.એલ.પી.નં.૧૮૧૩૬/૨૦૧૩ અને એસ.એલ.પી.નં.૮૮૫૦-૧૦૦૨૧/૨૦૧૨ ના આખરી ચુકાદાને આધિન નિમણૂક આપવામાં આવશે.
- (૪) વિદ્યાસહાયકને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ રૂ.૧૮૮૫૦/- ફિક્સ પગાર શિક્ષણવિભાગના તા.૦૮/૦૮/૨૦૧૭ના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૭/સીંગલફાઇલ-પ/ક ના ઠરાવમુજબ મળવાપાત્ર થશે. પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાશે તો, સરકારના નિયમાનુસાર જે તે જગ્યા માટે વખતો વખત નિયત કરેલ પગાર ધોરણમાં સમાવવામાં આવશે.
- (૫) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૭/સીંગલ ફાઇલ-૨૩/ક તા.૩૦/૦૮/૨૦૧૭ થી મેળવેલ મંજૂરી અનુસાર તેમાં દર્શાવેલ શરતો અને જોગવાઈ મુજબ જે તે જિલ્લાના નિયત કરેલ તાલુકાઓમાં વિદ્યાસહાયક ભરતી કરવામાં આવશે. જે તાલુકામાં નિમણૂક થશે તે જ તાલુકામાં દશ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે.
- (૬) કુલ ભરવાપાત્ર જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે ૧૦ ટકા જગ્યાઓ, એચ.એસ.સી.(વિજ્ઞાન પ્રવાહ) ૪૫ % ગુણ સાથે પાસ થયેલ ઉમેદવારો માટે ૧૦ ટકા જગ્યાઓ, મહિલા ઉમેદવારો માટે ૩૩ ટકા જગ્યાઓ અને શારીરિક અશક્તતા ધરાવતાં ઉમેદવારો માટે ૩ ટકા જગ્યાઓ અનામત છે.
- (૭) વયમર્યાદા: પ્રાથમિક વિભાગના વિદ્યાસહાયક માટે તા.૧૪/૦૮/૨૦૧૭ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૩ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં. મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારોમહિલા, શારીરિક રીતે અશક્ત(PH) તથા માજી સૈનિકો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટમળવાપાત્ર છે. છુટછાટ સાથેની ઉંમર નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઈએ નહીં.
- (૮) ઉમેદવારને કોલ લેટરમાં દર્શાવેલ તારીખે જ જિલ્લા પસંદગી આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં તે પછીની તારીખે પસંદગીની તક આપવામાં આવશે નહીં. જિલ્લા પસંદગી માટે ઉમેદવારે જે તે જ હાજર રહેવાનું રહેશે.
- (૯) યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા મેળવેલ ડીગ્રી ગ્રાહ્ય રાખવામાં આવશે. રાજ્ય બહારની Open and Distance Learning દ્વારા મેળવેલ ડીગ્રી માન્ય ન હોઈ તેવી લાયકતા ગ્રાહ્ય રહેશે નહીં.
- (૧૦) એક કરતાં વધુ પ્રયત્ને એચ.એસ.સી/સ્નાતક/પીટીસી ની અંતિમ પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક: જીએચ/એસએચ/૦૨/પીઆરઈ/૧૧-૨૦૧૬/ એસએફ-૮/કિ તા.૨૦/૦૧/૨૦૧૭ માં દર્શાવેલ ૮ (૨) મુજબ ગુણ ગણતરી કરી મેરીટ ગણવામાં આવશે.
- (૧૧) હાલ જિલ્લા/નગર શિક્ષણ સમિતિમાં નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ માં ફરજ બજાવતાં હોય તેવા વિદ્યાસહાયક/શિક્ષક આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારોએ શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૧૭/સીંગલ ફાઇલ- ૬/ક, તા.૨૨/૦૩/૨૦૧૭ મુજબ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. મેળવ્યા બાદ અરજી કરવાની રહેશે. જિલ્લા પસંદગી માટે ઉપસ્થિત રહેનાર એન.ઓ.સી. મેળવનાર ઉમેદવારોએ રાજીનામું મંજૂર કરાવેલ હશે તો જ જિલ્લા પસંદગી માટે પાત્ર ગણાશે. એન.ઓ.સી. મેળવ્યા સિવાય અરજી કર્યાની બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો અરજી રદ થવાને પાત્ર રહેશે.
- (૧૨) જે ઉમેદવાર નોકરી કરે છે તે બાબત છુપાવીને અરજી કરે તેવા કિસ્સામાં હાલની નિમણૂક રદ કરી તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
- (૧૩) વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાની આવશ્યકતા જણાશે તો તેમ કરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ/પ્રાથમિક શિક્ષણ નિયામકને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે.

તા.૦૧/૦૮/૨૦૧૭

સ્થળ: ગાંધીનગર

જાહેરાત ક્રમાંક:વિસભ:૦૧/૨૦૧૭-૧૮

ડૉ. એમ.આઈ.જોષી

અધ્યક્ષ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ

અને પ્રાથમિક શિક્ષણ નિયામક

ગુજરાત રાજ્ય ગાંધીનગર